

ઓરીસ્સા ગંજામ જીલ્લાના આસ્કા પો.સ્ટે. વિસ્તારના ચકચારી મર્ડર તથા ખંડણીના ગુનામા નાસતા-ફરતા

આરોપીઓને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાચ.

તારીખ ૭/૧૧/૨૦૧૭ ના રોજ પ્રતાપ પોલાઈ તેઓની પત્ની બબીતા પોલાઈ જે સ્થાનિક કોર્પોરેટર છે તેઓ સાથે બસમાં જતા હતા દરમ્યાન આરોપી (૧) શીલુ પોલાઈ (૨) રવી નાહક (૩) સાઈ પોલાઈ નાઓએ બસ રોકી બસમાં પ્રતાપ પોલાઈની તેની ફેમીલી સામે માથાના ભાગે ગોળી મારી હત્યા કરી તમામ ત્યાંથી ભાગી ગયેલ જે અંગે આસ્કા પો.સ્ટે. ખાતે ૨૩/૧/૨૦૧૭ ઈ.પી.કો. ૩૦૨, ૧૦૯, ૩૪ તથા આર્મ્સ એક્ટ કલમ ૨૫, ૨૭ મુજબનો ગુનો નોંધવામાં આવેલ. આ ગુના સાથે સંકળાયેલ કુલ સાત આરોપીઓ સ્થાનિક પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ અને પ્રતાપ પોલાઈની હત્યા દેશી દાડૂના લાયસન્સ મેળવવા બાબતે આંતરીક વિખવાદથી થયેલ હોવાનું તથા આ ગુનામાં મુખ્ય આરોપી શીલુ પોલાઈએ હત્યા માટે કાવત્રુ રચી સહ આરોપીઓને પાંચ લાખ રૂપિયા આપવાનું નક્કી કરેલ હોવાનું તપાસ દરમ્યાન ખુલેલ હત્યા બાદ મુખ્ય શીલુ પોલાઈ ત્યાંથી ફરાર થઈ સુરત ખાતે રહેવા માટે આવી અને પોતાનો ભાઈ તથા ગેંગના અન્ય સભ્યો જેલમાં હોઈ તેઓને છોડાવા માટે તેની પાસે રૂપિયાની સગવડ ન હોઈ તે આસ્કા ટાઉન ઓરીસ્સા ખાતે અલગ અલગ વેપારીઓને સુરત ખાતે રહી ફોન કરી ધમકી આપી ખંડણી માંગી રૂપિયા કઢાવવાની શરૂઆત કરેલ અને આસ્કા ટાઉનમાં સોના-ચાંદીના વેપારી પાસે રૂપિયા ચાર લાખની ખંડણી માંગતા આસ્કા પો.સ્ટે. ખાતે ૩૩/૨૦૧૮ ઈ.પી.કો. ૩૮૬ મુજબથી ગુનો નોંધાયેલ. મજકુર શીલુ પોલાઈ તથા તેના સાગરીતોને જેલમાંથી બહાર નિકળવા રૂપિયાની વ્યવસ્થા થતી ન હોઈ શીલુ પોલાઈ તથા તેના સાગરીતોએ જેલમા બેઠા બેઠા સામાવાળાની હત્યાનો પ્લાન બનાવેલ અને હથીયારો સાથે સજ્જ થઈ હત્યા માટે જતા હતા દરમ્યાન સ્થાનિક પોલીસને આ બાબતે હકિકત મળતા તેઓના સાગરીતોએ તા.૨૪/૦૪/૨૦૧૮ ના રોજ તેઓને કોર્ડન કરી પકડવા જતા પોલીસ પાર્ટી પર દેશી બોમ્બ તથા ફાયરીંગ કરી હુમલો કરેલ જે બાબતે આસ્કા પો.સ્ટે.મા ૧૪૦/૨૦૧૮ ઈ.પી.કો. ૩૦૭, ૧૨૦(બી), ૩૫૩, ૩૪ આર્મ્સ એક્ટ ૨૫, ૨૭ તથા એક્સપ્લોઝીવ એક્ટ કલમ ૪ તથા ૫ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ વોલ્ટેડ આરોપી શીલુ પોલાઈ સુરત ખાતે રહી પોતાનું ગુનાહિત નેટવર્ક ચલાવતો હોઈ સ્થાનિક પોલીસ તેને પકડવા સુરત આવતી પરંતુ તેને પકડવામા સફળતા મળેલ નહી.

ત્રણ દિવસ અગાઉ આસ્કા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર સુરત ખાતે આવી સુરત શહેર ક્રાઈમ બ્રાંચનો સંપર્ક કરતા ક્રાઈમના ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. એમ.એસ.ત્રિવેદી તથા તેઓની ટીમે આરોપી શીલુ પોલાઈની તપાસ દરમ્યાન ગઈ કાલ તા.૧/૦૮/૨૦૧૮ ના રોજ (૧) મહાવિરસિંહ રણજીતસિંહ તથા (૨) યોગેન્દ્રસિંહ દિલુભા નાઓને મળેલ બાતમી આધારે ભેસ્તાન શીવનગર સોસાયટી પાસેથી આરોપી (૧) ગૌતમ @ શીલુ કણ્ણાકર પોલાઈ ઉ.વ-૨૯ ધંધો-બેકાર રહે-શીવનગર સોસા., ભેસ્તાન ચોકડીની બાજુમાં, પાંડેસરા, સુરત મુળ ગામ-પક્કલ્લાપલ્લી પો.સ્ટે-આસ્કા જી-ગંજામ ઓરીસ્સા (૨) આદિત્ય રસાનંદ નાહક ઉ.વ-૨૨ ધંધો-બેકાર રહે-એજન (૩) મુકેશ સુભાષ શીઓ ઉ.વ-૧૯ ધંધો-અભ્યાસ રહે-ધરતી નગર, વરાછા, સુરત મુળ રહે-કુડકેશ્વર પલ્લી પો.સ્ટે-આસ્કા જી-ગંજામ ઓરીસ્સા નાઓને ઝડપી પાડી પુછ પરછ કરતા આરોપી નં. (૧) શીપુ પોલાઈ

(૧) આસ્કા પો.સ્ટે. ગુ.નં ૨૩/૧/૨૦૧૭ ઈ.પી.કો. ૩૦૨, ૧૦૯, ૩૪ તથા આર્મ્સ એક્ટ કલમ ૨૫, ૨૭

(૨) આસ્કા પો.સ્ટે. ગુ.નં ૩૩/૨૦૧૮ ઈ.પી.કો. ૩૮૬

(૩) આસ્કા પો.સ્ટે. ગુ.નં ૧૪૦/૨૦૧૮ ઈ.પી.કો. ૩૦૭, ૧૨૦(બી), ૩૫૩, ૩૪ આર્મ્સ એક્ટ ૨૫, ૨૭ તથા એક્સપ્લોઝીવ એક્ટ કલમ ૪ તથા ૫ ગુનામાં નાસતો ફરતો છે તેમજ અન્ય બે આરોપીઓ માત્ર આસ્કા પો.સ્ટે; ગુ.નં ૩૩/૨૦૧૮ ઈ.પી.કો ૩૮૬ ગુનામાં નાસતા-ફરતા હોઈ તેઓની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

મજકુર પકડાયેલ શીલુ પોલાઈની પુછપરછ કરતા તેના ભાગીદાર મરણ જનારની સાથે દેશી દાડૂનો સરકારી ટેન્ડર મેળવી વેચાણ કરતા જેમા મરણ જનાર તેઓથી અલગ થઈ પોતાનો સ્વતંત્ર દાડૂનો વ્યવસાય શરૂ કરેલ જેમા આરોપીઓને સરકારી લાયસન્સ મળેલ નહી આર્થિક રીતે મોટું નુકશાન ગયેલ જે વાતની અદાવત પોતે પ્રતાપ પોલાઈની હત્યાનો પ્લાન રચેલ અને તમામ સહ આરોપીઓને કુલ્લે પાંચ લાખ રૂપિયા આપવાનું નક્કી કરી સહ આરોપી રવી નાહક પાસે ત્રણ હથીયાર મંગાવી મરણ જનારની ઉપર વોચ શરૂ કરી બનાવના દિવસે અન્ય સહ આરોપીઓએ મરણ જનારની ટીપ આપતા પ્રતાપ પોલાઈની હત્યા કરવામાં આવેલ હત્યા બાદ તેના પરીવાર વાળા પકડાયેલ આરોપીઓના જામીન થવા દેતા નથી તેમ વેરભાવ રાખી તેઓના પરીવાર પર હુમલાનું કાવત્રુ રચેલ જેમા પોલીસને માહિતી મળી જતા પોલીસ પાર્ટી પર હુમલો કરી તેમને ઘાયલ કરેલ અને બાદમાં પોતાની પાસે રૂપિયાની સગવડ ન હોઈ તેના સાગરીતો મારફતે આસ્કા ટાઉન ખાતેના મોટા વેપારીઓના નંબરો મેળવી તેઓને જાનથી મારી નાંખવાની ધમકી આપી ખંડણી માંગી રૂપિયા કઢાવવાનું શરૂ કરેલ હોવાની કબુલાત કરેલ છે.

મજકુર પકડાયેલ શીલુ પોલાઈ આસ્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘાડની તૈયારી-૩, લુટ-૧, મર્ડર-૧, ખુનની કોશીષ-૧, મારા-મારીના-૮, ટેન્ડર ફીક્સીંગ-૧ ગુનામા પકડાઈ ચુકેલ છે.